

Date: 09<sup>th</sup> September, 2023  
To,  
BSE Limited,  
P. J. Tower, Dalal Street,  
Fort, Mumbai.  
Kind Attn: Manager, Listing Department  
Stock Code – 539982

Dear Sir/Madam,

**Sub.: Extract of Newspaper Advertisement - Regulation 47 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015**


Dear Sir,  
This is in continuation to our letter dated 08<sup>th</sup> September, 2023 wherein we had given intimation of the 33<sup>rd</sup> Annual General Meeting ("AGM") of **ADVANCE SYNTEX LIMITED** ("the Company") and enclosed the Notice of the AGM, together with the Annual Report of the Company for the financial year 2022-2023.

In compliance with the Regulation 47 and other applicable provisions of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 ("the Listing Regulations"), please find enclosed the extract of the public notice published by the Company today, i.e. 09<sup>th</sup> September, 2023 in Business Standard (in English language) and Loksatta (in Gujarati language) newspapers.

The enclosed public notices are issued by the Company in compliance of the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, General Circular No. 14/2020 dated April 8, 2020, No. 17/2020 dated April 13, 2020 and No. 20/2020 dated May 5, 2020 issued by the Ministry of Corporate Affairs and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020.

Kindly take the above information on record and acknowledge the receipt.

Thanking you,  
Yours faithfully  
FOR ADVANCE SYNTEX LIMITED



**BHAVAN VORA**  
(MANAGING DIRECTOR)  
DIN NO. 01613974

### AERPACE INDUSTRIES LIMITED (FORMERLY KNOWN AS SUPREMX SHINE STEELS LIMITED)

Regd. Office : 1005, 10th Floor, A Wing, Kanakia Wall Street, Anandri Kuria Road, Anandri (East), Mumbai-400093  
CIN : L74110MH2011PLC214373

**NOTICE OF 12TH ANNUAL GENERAL MEETING**

NOTICE is hereby given that the 12th Annual General Meeting (AGM) of the Members of Aerpace Industries Limited (Formerly known as Supremx Shine Steels Limited) will be held on Wednesday, 27th September, 2023 at 12:00 PM. IST through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") to transact the businesses, as set out in the Notice of AGM which is being circulated for convening AGM.

In view of the massive outbreak of the COVID-19 pandemic, social distancing is a norm to be followed and pursuant to the Circular dated 8th April, 2020, 13th April, 2020, 5th May, 2020, 13th January, 2021, 8th December, 2021, 14th December, 2021 and 5th May, 2022 (collectively referred to as "MCA Circulars") and SEBI vide its Circular No. SEBI/HO/CFD/PoD-2/PIR/2023/4 dated 5th January, 2023, Circular No. SEBI/HO/CFD/CMD/2/CIR/PI/2022/62 dated 13th May, 2022, Circular No. SEBI/HO/CFD/CMD/1/CIR/PI/2020/79 dated 12th May, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD/2/CIR/PI/2021/11 dated 15th January, 2021 (collectively referred to as "SEBI Circulars") and all other relevant circulars issued from time to time, physical attendance of the Members to the AGM venue is not required and general meeting be held through video conferencing (VC) or other audio visual means ("OAVM"). Hence, Members can attend and participate in the ensuing AGM through VC/OAVM.

In accordance with the MCA Circulars and the SEBI Circular dated 12th May, 2020, and 15th January, 2021 the Notice along with the Annual Report of the Company for the financial year ended 31st March, 2023, will be sent only through e-mail, to those Members whose e-mail addresses are registered with the Company or the Registrar and Share Transfer Agent (the "RTA"), i.e., M/s. Purva Sharegistry Private Limited or the Depository Participant(s). The Notice and the Annual Report for the financial year ended 31st March, 2023 shall be available on the website of the Company viz., www.supremxshinesteels.in and of the Stock Exchange where Equity Shares of the Company are listed www.bseindia.com. The Notice shall also be available on the e-Voting website of the agency engaged for providing e-Voting facility, NSDL (agency for providing the Remote e-Voting facility) i.e. https://evoting.nsdl.com/.

Remote e-voting facility is provided to Members to cast their votes on any of the resolutions set out in the Notice of the AGM. Members have the option to cast their vote using the remote e-voting facility prior to the AGM or during the AGM. Detailed procedure for remote e-voting is provided in the Notice of AGM.

The remote e-voting period begins on Sunday, 24th September, 2023 at 09:00 A.M. and ends on Tuesday, 26th September, 2023 at 05:00 P.M. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The Members, whose names appear in the Register of Members / Beneficial Owners as on the record date (cut-off date) i.e. Wednesday, 20th September, 2023, may cast their vote electronically. The voting right of shareholders shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as on the cut-off date, being Wednesday, 20th September, 2023.

The detailed instructions for joining the AGM through VC/OAVM and casting the vote through remote e-voting / e-voting at the AGM is provided in the Notice of AGM. Members are requested to carefully go through the same. If you have any queries or issues regarding attending AGM & e-Voting from the NSDL e-Voting System, you can write an email to evoting@nsdl.com.

The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday, 21st September, 2023 to Wednesday, 27th September, 2023 (both days inclusive) for the purpose of Annual General Meeting.

By order of the Board of Directors For Aerpace Industries Limited  
Sd/- Milan Shah Managing Director DIN:08163535  
Place: Mumbai Date: 02-09-2023

### IDFC FIRST Bank Limited

(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
CIN : L65110TN2014PLC097792  
Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL : +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

#### APPENDIX IV (Rule 8(1)) POSSESSION NOTICE (For immovable property)

Whereas the undersigned being the Authorised Officer of the IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the securitization and reconstruction of financial assets and enforcement of security interest act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand notice dated 30-10-2021 calling upon the borrower, co-borrowers and guarantors 1. **Shahidhah Usmambhai Muman, 2. Rubinaben Shahidhah Muman**, to repay the amount mentioned in the notice being **Rs. 8,00,856.22/- (Rupees Eight Lac Eight Hundred Fifty Six And Twenty Two Paise Only)** as on 27.10.2021, within 60 days from the date of receipt of the said Demand notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **physical possession** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of act read with rule 8 of the security interest (enforcement) rules, 2002 on this 5<sup>th</sup> day of Sep 2023.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of **Rs. 8,00,856.22/- (Rupees Eight Lac Eight Hundred Fifty Six And Twenty Two Paise Only)**, and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-Section (8) Of Section 13 of the act, in respect of time available, to redeem the secured assets.

**Description of the Immovable properties**

All That Piece And Parcel Of The Residential Property Out Of Koita Gram Panchayat, Property No. 5/31/6, In Old Gamtal, Total Admeasuring 1200 Sq. Fts. Situated At "Mumnavas" In The Sim Of Koita, Taluk-Sarswati, Dist-Patan, State-Gujarat, And Bounded As : East: House Of Ahmad Taju, West : House Of Iqbal Gulam, North : House Of Umar Taju Daud, South : Road

Sd/-  
Date : 5<sup>th</sup> Sep 2023 Authorised Officer  
Place : Patan IDFC First Bank Limited  
Loan Account No : 33403037 (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
& 22864548.

### Form No.URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI (Pursuant to section 374 (b) of the companies Act, 2013 and rule 4(1) of the Companies (Authorized to Register) Rules, 2014)

- Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application has been made to the Registrar at Central Registration Centre (CRC) Indian Institute of Corporate Affairs (IICA) Plot No. 6, 7 & 8, Sector 5, I.M.T, Manesar; District - Gurgaon; Haryana, India; PIN - 122052 at that (CROWN GLOBE) a partnership firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.
- The principal objects of the company are as follows:  
To carry on the business of financial analysis, accounting, pay-roll, providing consultancy to offer in India and outside India
- A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at B - 901, Ratanakar Nine Square, Opp. ITC Narmada, Satellite, Ahmedabad 380015, Gujarat, India.
- Notice is here by given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC) Indian Institute of Corporate Affairs (IICA) Plot No. 6, 7 & 8, Sector 5, I.M.T, Manesar; District - Gurgaon; Haryana, India; PIN - 122052 within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Dated this 09<sup>th</sup> day of September, 2023 at Ahmedabad.

Names of Applicant for and on behalf of CROWN GLOBE  
**1. Dixita Kunal Desai (Partner) 2. Anjani Kumar Das (Partner)**

**ESSAR SHIPPING LIMITED**  
Reg. Office: EBTSL Premises, ER-2 Building (Admin. Building) Salaya, 44 Km, P.B. No 7, Taluka Khambhalla, Devbhumi Dwarka, Khambhalla, Jamnagar, Gujarat - 361305.  
CIN No.: L61200GJ2010PLC060285  
Email Id: esl.secretarial@essarshipping.co.in, Website: www.essar.com  
Corporate Office: Essar House, 11, K.K. Marg, Mahataxmi Mumbai - 400034.

**NOTICE OF 13<sup>th</sup> ANNUAL GENERAL MEETING OF THE COMPANY TO BE HELD THROUGH VIDEO CONFERENCE ("VC") / OTHER AUDIO VISUAL MEANS ("OAVM")**

NOTICE is hereby given that the 13<sup>th</sup> (Thirteenth) Annual General Meeting ("AGM") of the Shareholders of Essar Shipping Limited ("the Company") will be held on Friday, September 29, 2023 at 03:00 P.M. (IST) through VC/OAVM in compliance with the applicable provisions of the Companies Act, 2013 & Rules framed thereunder and the SEBI (LODR) Regulations, 2015 read with General Circular No. 20/2020, 14/2020, 17/2020, 20/2021, 03/2022 and 11/2022 dated May 5, 2020, April 8, 2020, April 13, 2020, December 8, 2021, May 5, 2022 and December 28, 2022 issued by SEBI (collectively referred to as "Circulars") issued by SEBI through Circulars to transact the business, as set out in the Notice of the AGM.

In compliance with the said Circulars, Notice of the AGM along with the Annual Report 2022-23 has been sent on September 07, 2023 through electronic mode to those members/shareholders whose e-mail addresses are registered with the Company's Registrar and Share Transfer Agent/Depositories. The Notice and Annual Report is available at the website of the Company www.essar.com and on the website of the Stock Exchange i.e. BSE Limited (at www.bseindia.com) and National Stock Exchange Limited (at www.nseindia.com) and on the website of NSDL (at www.evoting.nsdl.com).

Members who have not registered their e-mail address are requested to register the same in respect of shares held in electronic form with the Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form by writing to the Company with details of folio number and attaching self-attested copy of PAN card at esl.secretarial@essarshipping.co.in or to Data Software Research Company Private Limited at essar.shipping@dsr-cid.in

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide its Members facility to cast their votes electronically on all the resolutions set forth is the 13<sup>th</sup> Notice of AGM using electronic voting system of NSDL at www.evoting.nsdl.co.in

The members are informed that:

- The business set forth in the Notice of the AGM may be transacted through voting by electronic means;
- A person whose name is recorded in the Register of Members as on the cut-off date, Friday, September 22, 2023 shall only be entitled to avail the remote e-voting facility or voting at AGM;
- The remote e-voting through electronic means shall commence from Tuesday, September 26, 2023 (09:00 am) and ends on Thursday, September 28, 2023 (05:00 pm);
- Members who have voted through remote e-voting may attend the AGM but shall not be entitled to cast their vote again in the meeting;
- Members attending the AGM through VC/OAVM who have not cast their vote by remote e-voting shall be eligible to cast their vote through e-voting during the AGM;
- Persons who have acquired shares and become members of the Company after the dispatch of notice and who are eligible shareholders as on the cut-off date i.e. Friday, September 22, 2023, may contact write to NSDL on the email id evoting@nsdl.co.in or to Data Software Research Company Pvt Limited, our Registrar and Share Transfer Agent for obtaining credentials of remote e-voting;
- In case of any queries/grievances pertaining to e-voting you may refer the FAQ and remote e-voting user manual available at the "downloads" Section of www.evoting.nsdl.com or call NSDL on toll free no: 1800-222-990 or contact NSDL, Trade World, 4<sup>th</sup> Floor, Kamala Mills Compound, Senapat Bapat Marg, Lower Parel, Mumbai - 400013, Tel. No. :-91-22-24994738

Pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, September 22, 2023 to Friday, September 29, 2023 (both days inclusive).

### DEBTS RECOVERY TRIBUNAL-II

(Ministry of Finance, Government of India)  
4th Floor, Bhikhubhai Chambers, Near Kochrab Ashram, Paldi, Ahmedabad, Gujarat, Pincode-380006, Phone No: 079-26579343, Tele Fax No: 079-26579341  
Form No. 14 [See Regulation 33 (2)]

RP / RC No. 227/2018	OA No. 861/2016
Bank Of Baroda	Certificate Holder Bank
VS	
Mr. Vihar Arvind Brahmabhatt, & Ors.	Certificate Debtors

**DEMAND NOTICE**

To,  
C.D.No.1: Mr. Vihar Arvind Brahmabhatt, Sole Propretor of M/s. Dutta Corporation, At: 495/496, Sayaji Market, Sayajipura, Ajuwa Chowkdi, Baroda - 390019.  
C.D.No.2: Mrs. Monal Vihar Brahmabhatt, Defendant No.1 & 2 Both Residing at: B- 40, Smruti Society-2 Katargam GIDC Estate, Surat - 395004.  
C.D.No.3: Mrs. Minishaben Manishbhai Barot, 401, Krushnashraya, Nirvuti Colony, Karelibaugh, Vadodara - 390018.  
C.D.No.4: M/s Ritu Marketing Pvt. Ltd., D/1/A, 1st Floor, Road No.2, Sardar Estate, Behind Reliance Tower, Ajuwa Road, Vadodara-390019.  
And Also At: 416/417, Sayaji Market, Sayajipura, Ajuwa Chowkdi, Baroda-390019.  
C.D.No.5: Mr. Gaurav Bipinbhai Barot, G-5, Shivaly Apartment, Shukla Nagar, New Sama Road, Sama Vadodara-390002.

In view of the Recovery Certificate issued in O.A. No.861/2016 passed by the Hon'ble Presiding Officer, Debts Recovery Tribunal-II, Ahmedabad, an amount of **Rs.55,51,448.00 (Rupees Fifty Five Lacs Fifty One Thousand Four Hundred and Forty Eight 01/100) including interest as on 01.12.2016** and further interest on **02.12.2016** plus cost of **Rs. 83,000.00** is due against you. The recovery if any will be adjusted.

You are hereby called upon to deposit the above sum within 15 days of the receipt of the notice, failing which the recovery shall be made as per rules.

In additions to the sum aforesaid you will be liable to pay :

- Such interest and cost as payable in terms of Recovery Certificate.
- All costs, charges and expenses incurred in respect of the service of this notice and other process that may be taken for recovering the amount due.

Given under my hand and the seal of the Tribunal this day 23.08.2023. Sd/- Recovery Officer-II, Ahmedabad

Next Date : 16/09/2023

**ADVANCE SYNTAX LIMITED**  
(CIN: L17119GJ1990PLC014406)  
Regd. Office: 233/2 & 238/2, POR G.I.D.C RAMANGAMD, VADODARA, GJ- 391243  
Tel No.: +91-8980028937, E-mail: midas1002003@hotmail.com, Website: www.midassglitter.com

#### NOTICE FOR 33rd AGM, E-VOTING AND BOOK CLOSURE

NOTICE is hereby given that pursuant to Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014 the 33rd Annual General Meeting of the members of the Company will be held through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") on Friday, the 30th day of September, 2023 at 2:00 p.m. (IST), in compliance with General Circular No. 14/2020, 17/2020, 20/2020 issued in April & May, 2020 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs ("MCA"), Government of India and Securities and Exchange Board of India to transact the Business as contained in the Notice of the meeting.

In compliance with the above circulars, electronic copies of the Notice of the 33rd AGM and Annual Report 2022-23 have been sent to all the shareholders on 08/09/2023, whose e-mail addresses are registered with the company/depository participants. A copy of the same is available on the company website i.e. www.midassglitter.com and on the website of e-voting agency i.e. www.evoting.nsdl.com.

In compliance with section 108 of the Act read with Rule 20 of the Companies (Management & Administration) Amendment Rules, 2015, Reg. 44 of the SEBI Regulations and SS-2 issued by the Institute of Company Secretaries of India, the Company has 23rd September 2022, as the cut-off date to determine the eligibility to vote by remote e-voting, for participation or e-voting at the AGM. The Company is pleased to provide the members the facility, holding shares as on cut-off date i.e. 23rd September, 2023 to cast their votes electronically through remote e-voting or through e-voting system on all resolutions set forth in Notice, for which the company has engaged the service of National Depository Services Ltd as the E-Voting Agency. All the members are informed that:

- the ordinary and special business as set out in the notice of 33rd AGM will be transacted through voting by electronic means;
- the remote e-voting shall commence on Wednesday, 27/09/2023 at 09:00 A.M. (IST) and shall end on Friday, 29/09/2023 at 05:00 p.m. (IST).
- Members attending the 33rd AGM who have not cast their votes by remote e-voting shall be eligible to cast their votes through E-Voting during the AGM.
- any person, who becomes member of the company after sending of the Notice of 33rd AGM and holding shares as of the cut-off date i.e. 23rd September 2023, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or at company's Email id at cs@midassglitter.com. However, if a person is already registered with NSDL for remote e-voting then existing user id and password can be used for casting vote;
- members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the members who have cast their vote by remote e-voting prior to the 33rd AGM may participate in the 33rd AGM through VC/OAVM facility but shall not be entitled to cast their votes again through e-voting system during the 33rd AGM. c) a person whose name is recorded in the register of members or the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting, participating in the 33rd AGM through VC/OAVM facility and e-voting during the 33rd AGM. d) voting rights of the members shall be in proportion to their shares in the paid up equity share capital of the company as on the cut-off date i.e. 23rd September 2023.
- the Notice of 33rd AGM and the Annual Report 2022-23 are available on the Company's website and website of the BSE Limited at www.bseindia.com . The notice of the AGM is also available on the website of NSDL at www.evoting.nsdl.com;
- The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 23rd September 2023 to 30th September 2023 (both days inclusive) for the purpose of 33rd AGM.
- In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQ), for shareholders and e-voting user manuals for shareholders available at the help section of www.evoting.nsdl.com or send a request at evoting@nsdl.co.in or contact toll free no. 1800222990 who will also address the grievances connected with the voting by electronic means. Members may also write to company secretary at e-mail id: cs@midassglitter.com

For Advance syntax Limited  
Sd/- BHAVAN VORA Managing Director

**ESSAR SHIPPING LIMITED**  
Place: Mumbai Date: 07/09/2023  
For Essar Shipping Limited  
Sd/- Ms. Nisha Barnwal  
Company Secretary and Compliance Officer

### BLUE CHIP INDIA LIMITED

CIN : L65991WB1993PLC060597

Regd. Office : 10 Princep Street, 2nd Floor, Kolkata - 700072  
E : bluechipindialimited@gmail.com, W : www.bluechipind.com  
Phone : 91-33-40022880, Fax : 91-33-22379053

**NOTICE OF 38th ANNUAL GENERAL MEETING (AGM), E-VOTING INFORMATION AND BOOK CLOSURE**

Notice is hereby given that:

- The 38th (Thirty-Eighth) Annual General Meeting (AGM) of Members of the Company will be held on Friday, the 29th day of September, 2023 at 2:00 P.M. (IST) through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM"), in compliance with applicable provisions of Companies Act, 2013 and rules made there under, SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Secretarial Standard an General Meetings (SS-2) issued by Institute of Company Secretaries of India read with MCA's circular no. 10/2022 dated 28th December, 2022 and SEBI circular no. SEBI/HO/CFD/CMD2/CIR/PI/2022/62 dated 13th May, 2022.
- Members will be able to attend the meeting only through VC/OAVM and those members participating in the said AGM through VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.
- In Compliance with MCA Circulars and SEBI Circular, the Notice of 38thAGM including details and instructions for remote e-voting/e-voting at AGM and Financial Statements including Auditors' Report, Board's Report and related Annexures attached therewith (Collectively referred to as "Annual Report 2022-23" or "Annual Report") have been sent on 07.09.2023, in electronic mode, to all the members whose e-mail ids are registered with the Company's Registrar and Share Transfer Agents (RTA), M/s. Maheshwari Datamatics Pvt Ltd/their respective Depository Participant(s). This is also in accordance with the provisions of Section 101 of the Companies Act, 2013 readwith Rule 18 of the Companies (Management & Administration) Rules, 2014 and Rule 11 of the Companies (Accounts) Rules, 2014. The same are also available on the website of the company at www.bluechipind.com and can also be accessed from the website of Bombay Stock Exchange at www.bseindia.com, National Stock Exchange at www.nseindia.com and that of Calcutta Stock Exchange at www.cse-india.com
- The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Saturday, 23rd day of September, 2023 to Friday, 29th day September, 2023 (both days inclusive) for the purpose of Annual General Meeting. All members holding shares either in physical form or dematerialized form, as on the cut-off date, Friday 22nd September, 2023 are provided with the facility to cast their vote electronically (e-voting) on the business as set forth in the Notice of the 38th AGM, for which the company has engaged the services of Central Depository Services (India) Ltd as E-Voting agency. Members may cast their votes remotely (Remote E-Voting) or cast votes at the AGM (E-Voting), using electronic system provided by CDSL. The facility to cast vote electronically at the AGM (E-Voting) will be made available for members attending the AGM who have not cast their vote(s) by remote E-Voting.
- All the members are informed that:
  - The remote e-voting shall commence on Tuesday, 26th September, 2023at 9:00 A.M. (IST)
  - The remote e-voting shall end on Thursday, 28th September, 2023at 05:00 PM(IST).
  - Remote E-voting will not be allowed beyond the aforesaid date and time and the Remote E-Voting module shall be forthwith disabledby CDSL, upon expiry of the aforesaid period.
- The cut-off date for determining the eligibility to vote by electronic means and to attend the AGM is Friday, 22nd September, 2023. Members who have cast vote(s) through Remote E-Voting may attend the meeting but will not be entitled to cast their vote(s) at the AGM.
- Members may note that:
  - Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.
  - The Company has appointed Mr. Atul Kumar Labh, Practicing Company Secretary as the Scrutinizer to scrutinize the votingprocess in a fair and transparent manner.
- In case of any queries, you may refer the Frequently asked Question (FAQs) for Shareholders and e-voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call on toll free no. 1800225533. Members may also write to the Company Secretary at the Company's email address bluechipindialimited@gmail.com.

Place : Kolkata Date : 08.09.2023  
For Blue Chip India Limited  
Sd/- Neha Choral, Company Secretary

### PUBLIC NOTICE

Take notice that Rajeshbhai Gatorbhai Patel and Samirbhai Savajibai Makwana HUF are the owner having right, title, interest and possession of Sub Plot No. 99/D, "Shilpgram 3", Emerald Green Commercial and Housing Co-operative Society Ltd. Vibhag 3, Block No. 273, Mouje: Santaj, Taluka: Kalol, District Gandhinagar. Despite due diligence some of the original documents relating to the title of the said property are not found and traceable and are misplaced /lost. The documents misplaced/lost is originals of (1) sale deed dated 17/01/2009 registered at Sr. No. 256, (2) allotment deed dated 21/01/2008 registered at Sr. No. 404, (3) correction deed dated 03/10/2018 registered at Sr. No. 10327 & its original registration receipt. In such circumstances title clearance certificate is sought and therefore it is hereby inform that in case anybody have/ has any claim, right or interest of any nature relating to the above property or the document concern, the undersigned may be informed in writing with necessary proof within 14 days from the date of this notice. In the event if no objection is received within stipulated time then it would be deemed that any objection or dispute shall be deemed to have been waived and title clearance certificate of the above property shall be issued and would proceed further. The public at large and the concerned person may take note of the same. **Date : 09/09/2023**

**VMP Legal & Associates Solicitor & Advocates**  
423, Platinum Plaza, Judges' Bungalow Road,  
Bodakdev, Ahmedabad. Ph.: 079-26840304

### Divine Alloys and Power Co Limited - In Liquidation

Regd. Off.: Block A, 139, Regent Estate, 176/14/139, Raipur Road, Kolkata - 700 092, West Bengal

**E-Auction**  
Sale of Corporate Debtor as a Going Concern under the Insolvency and Bankruptcy Code, 2016  
**Date and Time of E-Auction: 03<sup>rd</sup> October, 2023 at 11:00 AM to 02:00 PM**  
(With unlimited extension of 10 minutes each)

**Sale Notice**  
Notice is hereby given for Sale of "M/s Divine Alloys and Power Co Limited - In Liquidation (Corporate Debtor)" as a Going Concern including all the assets forming part of Liquidation estate formed by the Liquidator, appointed by the Hon'ble NCLT Kolkata Bench under the Insolvency and Bankruptcy Code, 2016 and the regulations made thereunder.

Assets	Reserve Price	EMD Amount
Sale of Corporate Debtor as a Going Concern along with all assets including Land & Building, Plant & Machinery and Securities & Financial Assets.	Rs 38.30 Crores	Rs 3.83 Crores

The sale shall be subject to the Terms and Conditions prescribed in the "E-Auction Process Information Document" available at <https://nclt.auctiontiger.net> and [www.divinealloysandpower.co.in](http://www.divinealloysandpower.co.in) and to the following conditions:

- It is clarified that, this invitation purports to invite prospective bidders and does not create any kind of binding obligation on the part of the Liquidator or the Company to effectuate the sale. Liquidator of M/s Divine Alloys and Power Co. Limited reserves the right to suspend/abandon/cancel/extend or modify process terms and/or reject or disqualify any prospective bidder/offers at any stage of the e-auction process without assigning any reason and without any liability.
  - E-Auction will be conducted on "AS IS WHERE IS", "AS IS WHAT IS", "WHATSOEVER THERE IS" and "NO RECOURSE" basis through approved service provider, M/s. e-Procurement Technologies Limited (Auction Tiger) <https://nclt.auctiontiger.net>.
  - The last date for submission of Eligibility documents and Refundable Deposit as mentioned in the Process Documents is 21<sup>st</sup> September, 2023. Inspection Date- 22<sup>nd</sup> September, 2023 to 28<sup>th</sup> September, 2023. The Bid Documents details and EMD payment details should reach the office of the Liquidator physically or by E-mail at the address given below before 06:00 PM on 30<sup>th</sup> September, 2023.
  - Any modification in timelines and/or in the "e-auction process information document" including terms and conditions will be notified in the website of the Corporate Debtor i.e. [www.divinealloysandpower.co.in](http://www.divinealloysandpower.co.in).
  - For any query, contact Mr. Rajesh Kumar Agrawal, mobile- 9830201612, mail id- crip.divine@gmail.com or Contact: Mr. Praveen Kumar Thevar 9722778828 - 079 6813 6854/55/51; Email Id: praveen.thevar@auctiontiger.net.
- Date : 07.09.2023** **Rajesh Kumar Agrawal**  
**Place : Kolkata** **Divine Alloys and Power Co Limited - In Liquidation**  
**IBBI Regn No. : IBBI/IPA-001/PI-PF/2023/2017-2018/11722**  
AFA Valid till 28/11/2023  
1, Ganesh Chandra Avenue, 3<sup>rd</sup> Floor, Room No-301, Kolkata- 700013  
[crip.divine@gmail.com](mailto:crip.divine@gmail.com) / [rajesh521@yahoo.com](mailto:rajesh521@yahoo.com)

**VEEFIN SOLUTIONS LIMITED**  
(Formerly known as Veeфин Solutions Pvt Ltd)  
CIN : UT2900MH2020PLC347893  
Regd. Office: Off No - 601, 602 & 603, Neelkanth Corporate IT Park, Vidyanihar (W), Mumbai 400086. Email id: investors@veefin.com ,

### NOTICE OF THE THIRD (3<sup>rd</sup>) ANNUAL GENERAL MEETING & E VOTING INFORMATION

NOTICE is hereby given that the Third (3<sup>rd</sup>) Annual General Meeting ("AGM") of the Company will be held on Friday, 29<sup>th</sup> day of September, 2023 at 2.30 P.M. IST via Video Conference / Other Audio Visual Means to transact the business as mentioned in the Notice convening the AGM.

Pursuant to General circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 20/2021, 21/2021, 3/2022 and 10/2022 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 8, 2021, December 14, 2021, May 5, 2022 and December 28, 2022 respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/PI/2022/62 dated May 13, 2022 & Circular No. SEBI/HO/CFD/PoD-2/PIR/2023/4 dated January 5, 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular") and in compliance with the provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), the 3<sup>rd</sup> AGM of the Company is being conducted through VC/OAVM, without the presence of the shareholders at a common venue. Shareholders attending the AGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

The Company's Annual Report for the financial year 2022-23, containing, inter-alia, the Notice convening the AGM together with the explanatory statement along with Audited standalone and consolidated financial statements, Board report and other documents required to be attached thereto, has been sent on Thursday, 07<sup>th</sup> September, 2023 by electronic mode to all the members whose email addresses are registered with the Company/Depositories Participants ("DP's")/Registrar and Transfer Agent ("RTA"), in accordance with the aforesaid MCA Circulars and SEBI Regulations.

In case members who have not registered their e-mail address are requested to register the same in respect of shares held in electronic form with the Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form by writing to the Company's Registrar and Share Transfer Agent, Bigshare Services Pvt Ltd, Office No S6-2, 6<sup>th</sup> floor, Pinnacle Business Park Next to Ahura Centre, Mahakali Caves Road, Anandri (East) Mumbai - 400093. Members may note that the copy of Notice of 3<sup>rd</sup> AGM and Annual Report for Financial Year 2022-23 is available on the website of the Company, viz., [www.veefin.com](http://www.veefin.com) and on the website of the Stock Exchange viz., BSE SME platform at [www.bsesme.com](http://www.bsesme.com) respectively and also on the website of the National Securities and Depositories Limited ("NSDL") viz., [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com).

**BOOK CLOSURE FOR AGM:**  
NOTICE is hereby given that pursuant to Section 91 and other applicable provisions of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations 2015, that the Register of Members and Share Transfer Books of the Company will be closed from 23<sup>rd</sup> September, 2023 to 29<sup>th</sup> September, 2023 both days inclusive for the purpose of AGM.

**VOTING THROUGH ELECTRONIC MODE (E-VOTING):**  
Pursuant to the provisions of Section 108 of the Act, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, and Regulation 44 of the SEBI Listing Regulations, the Company is pleased to provide all its Members the facility to cast their vote electronically, through the remote e-voting services provided by NSDL. Members of the Company holding shares in physical or dematerialized form as on the cut-off date i.e. Friday, 22<sup>nd</sup> September, 2023, may cast their vote through remote e-voting.

All the Members are informed that:

- all of the business as set out in the Notice of 3<sup>rd</sup> AGM may be transacted through remote e-voting;
- remote e-voting shall commence on Monday 25<sup>th</sup> September, 2023 (09:00 am) IST;
- remote e-voting shall end on Thursday, 28<sup>th</sup> September, 2023 (till 05:00 pm) IST;
- remote e-voting shall not be allowed beyond 5.00 p.m. on Thursday, 28<sup>th</sup> September, 2023;
- the facility for voting through electronic voting system shall also be made available for Members present at the AGM.
- Member may participate in the AGM even after exercising his vote, by remote e-voting, but shall not be allowed to vote again in the AGM;
- Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently;
- Only a person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date Friday, 22<sup>nd</sup> September, 2023 shall be entitled to avail the facility of remote e-voting or voting through electronic voting system at the AGM;
- Any person, who acquires shares of the Company and becomes a member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date i.e. Friday, 22<sup>nd</sup>

નર્મદા ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ.૫.૩૨ કરોડનું ટેન્ડર બહાર પડાયું



રાજપીપળા,તા.૮

માટે બીડ મંગવાઈ છે. એસ.એસ.એન.એલ દ્વારા એ લાઈટિંગ પ્રોજેક્ટ પૂર્ણ થયે થી બે વર્ષ માટે ડિઝાઈન, સધાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ સાથે ડોકોરેટિવ લાઈટ અને સાઈન જે માટે આપરેશન અને મેન્ટેનન્સ માટે બીડ મંગવાઈ છે.નર્મદા ડેમ પર ડોકોરેટિવ લાઈટિંગ માટેના રૂપિયા ૫.૩૨ કરોડના ટેન્ડરમાં ૧૪,૧૨૦ લેગર, એલ.ઈ.ડી. ફલ્ક સહિતની લાઈટોનો સમાવેશ કરાયો અને નિભાવ સાથે સંચાલન બર્ચનો પણ ૨ વર્ષ માટે સમાવેશ કરાયો છે.

વિશ્વ પ્રવાસન સ્થળ બની ગયેલા કેવડિયા એકતાનગર સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાતે માટે ગુજરાતની જવાબદારી સમા નર્મદા ડેમ પર ડોકોરેટિવ આકર્ષક લાઈટિંગ માટે ૫.૩૨ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પડાયું છે.વડોદરાના નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૦ માં સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રકલ્પો સાથે સરદાર સરોવર નર્મદા ડેમની ડોકોરેટિવ લાઈટિંગનું પણ ઉદ્દઘાટન કરાયું હતું. ત્રણ વર્ષ પૂર્ણ થતાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ૩ માં વાર લાઈટિંગ

પશ્ચિમ રેલવે-વડોદરા ડિવિઝન એલએન્ડ-વેટરેનરી ડિપાર્ટમેન્ટ ઈલેક્ટ્રીકલ કામ ઈલેક્ટ્રીકલ કામ ટેન્ડર નં.: EL/TRD/Tender/23-24/19 બહારના રજીસ્ટ્રેશન વગેરે માટે ઇલેક્ટ્રીકલ રેલવે મેનેજર (ઈલેક્ટ્રીકલ ટીઆરડી) પશ્ચિમ રેલવે, આમદાવાદ, વડોદરા-૩૯૦૦૦૪ દ્વારા નીચેના કામ માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવે છે. કામ. રૂ. ૧ ટેન્ડર નં. અને કામનું નામ: EL/TRD/Tender/23-24/19 વડોદરા ડિવિઝનના સુરત-નેલવર, વડોદરા-ડબલ ડિવિઝન-ગોધરા સેક્ટરના 12 મીટર પહોળા ફર અકાઉન્ટ ફોલોઅર અને અન્ય અલેક્ટ્રીકલ યુનિટવિદ્યાના સંબંધમાં અલેક્ટ્રીકલ માં ઉમેરો અને ફેરવેલ. કામની જાહેરાત પત્ર (R માં): 3,97,82,064.20 જામ કરવામાં આવેલ પત્રની (R માં): 3,48,900/- ટેન્ડર દેખાડેવાની પદાર અને પુસ્તકોનો સમયાવધિ: રજીસ્ટ્રેશન સમયાવધિ 12 મીટરના ટેન્ડર પુસ્તક: ટેન્ડર બંધ થવાની તારીખ 04.10.2023 અને ટેન્ડર બંધ થવાનો સમય એ જ તારીખે. 15.00 કલાકે વેબ પેજ વિભાગે અને નોટીસ બોર્ડને અથવા ફાઈલો સંપૂર્ણ વિભાગે જોઈ શકાયો અને ઓફિસ અને સ્પષ્ટીકરણ સંબંધ: વેબસાઈટ: www.ireps.gov.in ડિવિઝનલ ઇન્ચાર્જ (ઈલેક્ટ્રીકલ ટીઆરડી), પશ્ચિમ રેલવે, આમદાવાદ, વડોદરા-390004. (EL/TRD/Tender/23-24/19 dttd. 05.09.2023) 169

ઇ.એલ.સી.બી લગવાનો વીજ અકસ્માત નિવારો... મધ્ય ગુજરાત વિજ્ઞાન કેન્દ્રની નીચી વિદ્યુત પુરવઠો બંધ કરાવવાની નોટીસ લાઈટ બંધની ફરિયાદ ના નિવારણ માટે કોન નંબર 1૯1૨૪૨ અથવા ટોલ ફ્રી નંબર 1૮૦૦૨૩૩૨૬૦૦ નો સંપર્ક કરવો અમારા માનવતા વિજ્ઞાનકેન્દ્રને જણાવવામાં આવે છે જે ટૂંક સમયમાં અમે નીચેના વિસ્તારનો વિજ્ઞાનકેન્દ્ર સવારના ૦૭-૦૦ થી ૧૧-૦૦ વધુ રહેશે. સમારકામ પૂર્ણ થયેથી વિદ્યુત પુરવઠો અંગતીથી કોઈપણ જાતની જાણ કરી સિવાય ચાલુ કી દેવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી છે. તારીખ: ૧૩.૦૯.૨૩ ને બુધવાર, ગોળી સમઝીતિઓ, ટી.બી. ડોલિવિલ ફિલ્ડ, નર્મદા ગેટ હાઉસ, સેન્ટ્રલ એક્સાઈઝ, ઈન્ડિયન, માઉલ આર્ક, સેન્ટ્રલ નગર, ગોમન નગર, કમ્પા સોસા, બારીકા સોસા.કેપી પેલેટીના તમજ આજુ બાજુનો વિસ્તાર, તારીખ: ૧૬.૦૯.૨૩ ને શનિવાર, ગોળી સમઝીતિઓ, સેન્ટ્રલ એક્સાઈઝ, સીડીબેક, અધિકાર, વેડેસાઈટ, બુધુ સોસા.તા એટલાન્ટિક સોસા. નો વિસ્તાર, સવાંય, કેપી ઈન્નીટી, સાઈન પ્લાઝા, શરણકા સોસા, Sd/- સંબંધિત સર્કલ ઇન્ચાર્જ (સં.એલ.બી.) વિદ્યામણી પશ્ચિમ વિભાગ, વડોદરા.

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના વતી કરાવવાલ છેલ્લે સુધી, રાજપીપળા (તા.મ) વિભાગ, રાજપીપળા જિ. નર્મદા ક્ષેત્રમાં ૦૨૬૭૦-૨૨૨૨૩ દ્વારા ચંદુ.૦૧ માટે યોગ્ય ભેદીમાં નોંધણી ધરાવતા છબાઈને પાસેથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર જોન લાઇન ડેન્ડર માંગવામાં આવેલ છે. (પત્ર) કામેના ડેન્ડર ડોક્યુમેન્ટ વેબસાઈટ https://mb.nprocure.com થતા માહિતી વિભાગ સાઈટ www.statetenders.com પરથી અનુ.નં.૦૧ નં કામ તા.૨૬/૦૯/૨૦૨૩ ના રોજ ૧૮૦૦ કલાક સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડેન્ડર કીના ડીડી અને બાબતની રકમની એક ડી. / બાનુમતિ પ્રમાણપત્ર તેમજ નોંધણી પ્રમાણપત્ર સાથે જોનલાઇન કોર્પો માં (ટેકમ) મોકલવાના રહેશે. અને અનુ.નં.૦૧ ના કામના ડોક્યુમેન્ટ ડેન્ડર કીના ડીડી અને બાબતની રકમની એક ડી.બાનુમતિ પ્રમાણપત્ર તેમજ નોંધણી પ્રમાણપત્ર બેન્ક સોલવન્સી વગેરે તા.૨૭/૦૯/૨૦૨૩ થી ૦૩/૧૦/૨૦૨૩ ના રોજ ૧૧.૦૦ કલાક સુધી રજૂ.પોચેડી સ્પષ્ટી પોર્ટ થી કરાવવાલ છેલ્લે સુધી, રાજપીપળા (તા.મ) વિભાગ, રાજપીપળાની કચેરીએ મોકલી આપવાના રહેશે. ઇ-ટેન્ડર નોટિસ ના અનં.૫૧ થી ૫૫ મુજબ ના દસ્તાવેજ સેલન કરીને રજૂ કરવામાં નહીં આવે તો તેવા ડેન્ડરને નોંધણી ગણવામાં આવશે. ડેન્ડર કી તેમજ બાબતની રકમ નિવેશન પ્રમાણપત્ર છબાઈથી બહાર કાઢી શકી શકાય તેવી છે. જો ઇજારદારશ્રીની નોંધણી એક વર્ષ માટે અલ્ટિમેટ માં રાખવામાં આવેલી કમીમાં આવશે તથા ઇ-ટેન્ડર નોટિસ નો એક એક વર્ષ માટે ૨૬ કરોડો વધુ માહિતી માટે વિગતવાર નોટિસ ઉપરોક્ત વેબસાઈટ પર જોવા મળશે. આ કામને અંગેના તમામ સુધારા વધારા જોનલાઇન જોવા મળશે. (માહિતી/નર્મદા/૨૩૦૨૨૩-૨૩)

NOTICE Notice is hereby given that the 30th Annual General Meeting (AGM) of the members of the Company will be held on Friday, 29th September, 2023 at 11.00 a.m. through video conferencing (VC) / Other Audio-Visual Means (OAVM) to transact the business as set out in the notice convening the AGM dated 11th August, 2023, in compliance with the General Circular No. 10/2022 dated December 28, 2022 read with circulars dated May 5, 2022, January 31, 2021, May 5, 2020, April 9, 2020 and April 13, 2020 (collectively referred to as "MCA Circulars") and the latest SEBI Circular No. SEBI/IM/C/D/P/2021 CIR/P/2023/120 dated July 11, 2023. The Company had already published notice in English newspaper (Business Standards) dated 29th August, 2023 and Gujarati newspaper (Loksaati) dated 30th August, 2023 requesting shareholders to register their email addresses and other details with the Company. The Company's Registrar and Share Transfer Agent "Cameo Corporate Services Limited" has sent the annual report for FY 2022-23 along with the said notice on 27th September, 2023 through electronic mode (e-mail) to those members whose e-mail addresses were registered with the Company / Depository Participant / Registrar and Share Transfer Agent. Notice is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013, the register of members and share transfer books of the Company shall remain closed from Saturday, the 23rd September, 2023 to Friday, the 29th September, 2023 (both days inclusive) for the purpose of a general meeting. Notice is also hereby given Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the Company is pleased to provide the members with the facility to cast their votes electronically (remote e-voting). The remote e-voting period commences at 9.00 a.m. (IST) on Tuesday, 26th September, 2023 and ends at 5.00 p.m. (IST) on Thursday, 28th September, 2023. Any person, who is member of Company holding shares as on the cut-off date i.e. Friday, 22nd September, 2023 is eligible to cast their votes on all resolutions using remote e-voting facility. The remote e-voting facility shall not be allowed beyond the said date and time. Any query or grievances in relation to remote e-voting may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdeskevoting@cdsindia.com. The Annual report of the Company for FY 2022-23 along with the notice of AGM and detailed e-voting instructions is also available on the website of Bombay Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com.

મારું નામ રાધાપ્રધારી ચંદ્રહાસ રવ હવુ બદલીને અમિતા હેમંતભાઈ બ્રહમભટ્ટ રાખેલ છે. અંબે માતા મંદિર પાસે, કાશીપુરા, સરાર, વડોદરા.

મારું નામ નીરા (Nira) મયુર કંદોઈ હવુ બદલીને નીરા (Neera) મયુર મયુર કંદોઈ રાખેલ છે. ૨૧/૪૦૪, મોનાલીસા, માંજલપુર, વડોદરા.

મે.વડોદરાના પ્રિન્સીપાલ ડીરેક્ટ જજ શ્રી ઉત્કર્ષ કાશરભાઈ દેસાઈ સાહેબની કોર્ટમાં, વડોદરા. કાર્ય ચલાવું રચના: બી/૨૬, પહેલો માળ, વેકેટીની ઈસ્ટી, નજીક, ન્યાય મંદીર, અકોટા, વડોદરા.

જાહેર સમગ્ર ઓ.એ.સી.પી. ઈ.વી.સી. ૮ / ૨૦૨૨ મુદત તા.૧૧-૦૯-૨૦૨૩ અરજદાર : આરતીબેન ભાવેશભાઈ સાહ વિગેરે વિરુદ્ધ સામીવાળા : (૨) મે. નીતીન ચાહ એવક કોમ્પ્લેક્સ, સાચણાંચ, વડોદરા. એ.એસ.બી. ૩૬, પેટેડાઈટ કોમ્પ્લેક્સ, સાચણાંચ, વડોદરા. આથી આ જાહેર નોટીસથી ઉપર લખ્યા સામાવાળા નાઓને જાણ કરવામાં આવે છે, આ કામના અરજદારોએ એ.એ.સી.પી. કેસ નં. ૨૨૧૫ / ૧૯૮૯ ના કોર્ટમાં જજ એન.જી.ડી.કીમાં અરજદારોના વકીલાના નામમાં નોંધણી કરવા માટે ઉપરોક્ત નંબરથી ઈ.વી.સી. ટાઇમ કરવે છે અને તેમાં જણાવ્યા પ્રમાણેના સરનામે તેમો સામાવાળા નાઓને નામ. કોર્ટ દ્વારા સમગ્ર હોદાવમાં આવતા જે સમગ્ર તેમો સામાવાળા નાઓને સરનામે પાલિકા પાલિકા ઈ.વે. જેથી આ કામની ફેર મુદત તા. ૧૧-૦૯-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મુકર કરવામાં આવેલ હોય, તો સરદાર તરીકે તેમણે જાતે અથવા યોગ્ય રીતે માહિતગાર કરેલ વકીલ મારફત આ કોર્ટમાં હાજર રહેવું જોઈ આવે કમીમાં સરદારો તો સરદાર અરજ સાબળીને તેનો ન્યાયિક નિર્ણય કરવામાં આવશે તેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. આજ રોજ તા. ૧૦-૦૯-૨૦૨૩ ના રોજ મારી સહી તથા સિક્કો કરેલ છે. તેવાર કરનાર :- એમ. ડી. કાશી મુજાબબ કરનાર :- એ.કી. પરમાર (સહી) /-, (રજીસ્ટ્રાર) જીલ્લા ન્યાયધિકાર, વડોદરા.

ફોલોવિંગ ઓવરસીઝ બેંક - વારસા ટોચ શાખા યુએ-૧-૨, કિલ્ડર ઓવરલેન્ડ, કા માટે વારસા રોડ ની સામે, વડોદરા, ગુજરાત-૩૬૦૦૨૧. ફોન: ૦૨૬૫-૨૨૫૦૨૬, ઈમેલ: lob1587@lob.in નોટીસ - ઘરેલાની જાહેર હરાયુ આથી સૂચના આપવામાં આવે છે કે: ૧. મુજુ પેપરના પ્રકાશન મુજબ, સોનાના આભૂષાણોની હરાયુ રૂ.૬૦૬.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે અમારી શાખા પરિસ્તરમાં હાથ ધરવામાં આવશે. ૨. હરાયુ શરૂ થવા પહેલાં, કિલ્ડરને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમનું કમ અમારી શાખામાં નોંધણી કરાવે, જરૂરી કમ્પ્લાઇન્સી ઓપરેશનલિઓનું પાલન કરવાપરશે. ૩. ઈલેક્ટ્રિકલ હરાયુ શરૂ થવા પહેલાં ઓળખાં ઓળખાં રૂ. ૧,૦૦૦/- જમા કરાવવાપરશે, બાબતની રકમ તરીકે. ૪. હરાયુ પછી તરત જ, સોની વધુ બિલ કરવાને બિન્ડની રકમમાંથી ૨૫% જમા કરાવવીપરશે. ૫. વધારાના રૂ. વધુ બોલી વાવખાર તેના હાથ રાખવામાં આવેલી બાબતની રકમ જમા કરવામાં નિષ્ફળ જશે તો જમા કરવામાં આવશે. ૬. વધારાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્ટિ આપવામાં આવેલી બાબતો. ૭. જો વેચાણની પુષ્ટિ થાય છે અને ઉચ્ચતમ કિલ્ડરને જાણ કરવામાં આવે છે, તો તેણે સૂચના પ્રાપ્ત થયાની તારીખથી ૩ દિવસની અંદર બાબતની રકમ જમા કરાવવીપરશે, વેચાણની પુષ્ટિ કરવીપરશે અને તે રકમમાં બિલ કિલ્ડરના કિલ્ડરમાં, તેના હાથ રાખવામાં આવેલી કિલ્ડરમાં રકમ. જમા કરવામાં આવશે. ૮. જો વેચાણની પુષ્ટિ થાય તો, કિલ્ડર દ્વારા જમા કરવામાં આવેલી રકમ કોઈપણ વ્યાજ વગર તેમ પડત કરવામાં આવશે. ૯. અવેકાઉન્ટ યુગ્વણ /જથ્થા માટે બેંક જવાબદાર નથી. ૧૦. બેંક કોઈપણ કારણ આપ્યા વિના કોઈપણ બિલ સ્વીકારવા અથવા નકારવાનો અધિકાર અનામત રાખે છે. ૧૧. સંબંધિત રજખમાં પ્રવર્તમાન હરે વેચાણ વેચે બિન્ડની રકમથી ઉપર અને બિલ કરનાર દ્વારા મોકલવાનો રહેશે. તારીખ: ૦૯-૦૯-૨૦૨૩ સૂચના વડોદરા નોંધ વિભાગની સ્થિતિમાં આ નોટીસનો અંતિમ અનુદાન માન્ય ગણાશે. અધિકૃત અધિકારી ઉપસ્થિતિ ઓવરસીઝ બેંક

VADODARA MUNICIPAL CORPORATION NOTICE RE-INVITING TENDER DOCUMENT Vadodara Municipal Corporation (VMC) Re-invites Tender from experienced, financially and technically sound firms interested in "PROCESSING OF WASTE LOCATED AT R.S. NO. 346 MAKARPURA USING SCIENTIFIC METHOD CONFORMING TO SWM RULES-2016." VMC intends to processing of waste lying at Makarpura site by setting up suitable plant using own vehicles and machineries, manpower and other necessary resources required to execute the work. VMC intends to appoint a firm to execute the work as per tender terms and condition and scope of work mentioned in bid document. Tender document can be seen from the website from D :- 11/09/2023 17:00 hrs. Other Details can be seen in the TENDER.

IN THE PUBLIC TRUSTS REGISTRATION OFFICE GREATER MUMBAI REGION, MUMBAI Dharmadaya Ayukta Bhavan, 1st floor, Sasmira Road, Worli, Mumbai- 400 030. Sasmira Building, 1st floor, Sasmira Road, Worli, Mumbai- 400 030. PUBLIC NOTICE OF INQUIRY Change Report No. ACC-II/1226/2023 U/s 22 of the Maharashtra Public Trust Act, 1950. Filed by Shri. Balkuntha Bihari Pati alias Braja Hari Das in the matter of "INTERNATIONAL SOCIETY FOR KRISHNA CONSCIOUSNESS" P.T.R. No. F-2179 (Bom) To: All concerned having interest - WHEREAS THE above named Reporting Trustee has filed a Change Report No. ACC-II/1226/2023 under section 22 of the Maharashtra Public Trusts Act, 1950 for bringing the below described property on the record of the above named trust and an inquiry is to be made by the Ld Assistant Charity Commissioner, (II), Greater Mumbai Region Mumbai viz., (1) Whether this property is the property of the trust and could be registered in the name of the trust? DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY- Add the following Trust Property Land of the north S. No. 161 of Village Vasna saiyad of Vadodara Taluka admeasuring 8449 Sq. Mtrs. Total sale Price of Rs. 2,53,470/- (Rupees Two Lakh Fifty Three Thousand Four Hundred Seventy only). This is to call upon you to submit your objections, if any, in the matter before the Ld Assistant Charity Commissioner (II), Greater Mumbai Region, Mumbai at the above address within 30 days from the date of publication of this notice, the inquiry would be completed & necessary orders will be passed. If no objections are received within the stipulated time then further inquiry would be completed and necessary orders will be passed. Given under my hand and seal of the Hon'ble Joint Charity Commissioner, Greater Mumbai Region Mumbai. This 5th day of the month of September, 2023. Seal) Sd/- Superintendent (J) Public Trusts Registration Office, Greater Mumbai Region, Mumbai.

UCO BANK (A Govt. of India Undertaking) ઝોનલ ઓફિસ સુરત, રીડી શોપર્સ, સ્ટાર બજાર સામે, અડાજણ હજીરા રોડ, સુરત. ફોન નં. 0261-2797700. બેંક ઈ-હરાજીથી વેચાણ : ક્રમ નં. 25-26 માટે તા. 13-10-2023 અને ક્રમ નં. 45-46 માટે તા. 26-09-2023

અરજદાર તરીકે વિ.પ.શ્રી. શશીકાંત એસ.વાઘેલા કિ.પ.અ.નં. 4415/2023 મે.વડોદરાના જુડીસી. એ.સી.સી. (સુબી) રીયા અરવાણ સાહેબની કોર્ટમાં અરજદાર : પર્માર અર્જુનભાઈ ઈશ્વરભાઈ સામાજિક : જમ શરૂ નાંઈથી અધિકારી/સહ સુરત સુરત સુરત : ૧૧૪૪, પાસાર ફળીયા, ડી.બી.સી.સી.સી., ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૦, ૮૧, ૮૨, ૮૩, ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૧૫૫, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૦, ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૭, ૧૬૮, ૧૬૯, ૧૭૦, ૧૭૧, ૧૭૨, ૧૭૩, ૧૭૪, ૧૭૫, ૧૭૬, ૧૭૭, ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૮૭, ૧૮૮, ૧૮૯, ૧૯૦, ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૪, ૧૯૫, ૧૯૬, ૧૯૭, ૧૯૮, ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૨૨૨, ૨૨૩, ૨૨૪, ૨૨૫, ૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૨૯, ૨૩૦, ૨૩૧, ૨૩૨, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૦, ૨૪૧, ૨૪૨, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૪૬, ૨૪૭, ૨૪૮, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૫૨, ૨૫૩, ૨૫૪, ૨૫૫, ૨૫૬, ૨૫૭, ૨૫૮, ૨૫૯, ૨૬૦, ૨૬૧, ૨૬૨, ૨૬૩, ૨૬૪, ૨૬૫, ૨૬૬, ૨૬૭, ૨૬૮, ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૩, ૨૭૪, ૨૭૫, ૨૭૬, ૨૭૭, ૨૭૮, ૨૭૯, ૨૮૦, ૨૮૧, ૨૮૨, ૨૮૩, ૨૮૪, ૨૮૫, ૨૮૬, ૨૮૭, ૨૮૮, ૨૮૯, ૨૯૦, ૨૯૧, ૨૯૨, ૨૯૩, ૨૯૪, ૨૯૫, ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૨૯૯, ૩૦૦, ૩૦૧, ૩૦૨, ૩૦૩, ૩૦૪, ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૦૮, ૩૦૯, ૩૧૦, ૩૧૧, ૩૧૨, ૩૧૩, ૩૧૪, ૩૧૫, ૩૧૬, ૩૧૭, ૩૧૮, ૩૧૯, ૩૨૦, ૩૨૧, ૩૨૨, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૨૯, ૩૩૦, ૩૩૧, ૩૩૨, ૩૩૩, ૩૩૪, ૩૩૫, ૩૩૬, ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૪૨, ૩૪૩, ૩૪૪, ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૪૮, ૩૪૯, ૩૫૦, ૩૫૧, ૩૫૨, ૩૫૩, ૩૫૪, ૩૫૫, ૩૫૬, ૩૫૭, ૩૫૮, ૩૫૯, ૩૬૦, ૩૬૧, ૩૬૨, ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૬૬, ૩૬૭, ૩૬૮, ૩૬૯, ૩૭૦, ૩૭૧, ૩૭૨, ૩૭૩, ૩૭૪, ૩૭૫, ૩૭૬, ૩૭૭, ૩૭૮, ૩૭૯, ૩૮૦, ૩૮૧, ૩૮૨, ૩૮૩, ૩૮૪, ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૩૮૮, ૩૮૯, ૩૯૦, ૩૯૧, ૩૯૨, ૩૯૩, ૩૯૪, ૩૯૫, ૩૯૬, ૩૯૭, ૩૯૮, ૩૯૯, ૪૦૦, ૪૦૧, ૪૦૨, ૪૦૩, ૪૦૪, ૪૦૫, ૪૦૬, ૪૦૭, ૪૦૮, ૪૦૯, ૪૧૦, ૪૧૧, ૪૧૨, ૪૧૩, ૪૧૪, ૪૧૫, ૪૧૬, ૪૧૭, ૪૧૮, ૪૧૯, ૪૨૦, ૪૨૧, ૪૨૨, ૪૨૩, ૪૨૪, ૪૨૫, ૪૨૬, ૪૨૭, ૪૨૮, ૪૨૯, ૪૩૦, ૪૩૧, ૪૩૨, ૪૩૩, ૪૩૪, ૪૩૫, ૪૩૬, ૪૩૭, ૪૩૮, ૪૩૯, ૪૪૦, ૪૪૧, ૪૪૨, ૪૪૩, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૪૫૧, ૪૫૨, ૪૫૩, ૪૫૪, ૪૫૫, ૪૫૬, ૪૫૭, ૪૫૮, ૪૫૯, ૪૬૦, ૪૬૧, ૪૬૨, ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૬૯, ૪૭૦, ૪૭૧, ૪૭૨, ૪૭૩, ૪૭૪, ૪૭૫, ૪૭૬, ૪૭૭, ૪૭૮, ૪૭૯, ૪૮૦, ૪૮૧, ૪૮૨, ૪૮૩, ૪૮૪, ૪૮૫, ૪૮૬, ૪૮૭, ૪૮૮, ૪૮૯, ૪૯૦, ૪૯૧, ૪૯૨, ૪૯૩, ૪૯૪, ૪૯૫, ૪૯૬, ૪૯૭, ૪૯૮, ૪૯૯, ૫૦૦, ૫૦૧, ૫૦૨, ૫૦૩, ૫૦૪, ૫૦૫, ૫૦૬, ૫૦૭, ૫૦૮, ૫૦૯, ૫૧૦, ૫૧૧, ૫૧૨, ૫૧૩, ૫૧૪, ૫૧૫, ૫૧૬, ૫૧૭, ૫૧૮, ૫૧૯, ૫૨૦, ૫૨૧, ૫૨૨, ૫૨૩, ૫૨૪, ૫૨૫, ૫૨૬, ૫૨૭, ૫૨૮, ૫૨૯, ૫૩૦, ૫૩૧, ૫૩૨, ૫૩૩, ૫૩૪, ૫૩૫, ૫૩૬, ૫૩૭, ૫૩૮, ૫૩૯, ૫૪૦, ૫૪૧, ૫૪૨, ૫૪૩, ૫૪૪, ૫૪૫, ૫૪૬, ૫૪૭, ૫૪૮, ૫૪૯, ૫૫૦, ૫૫૧, ૫૫૨, ૫૫૩, ૫૫૪, ૫૫૫, ૫૫૬, ૫૫૭, ૫૫૮, ૫૫૯, ૫૬૦, ૫૬૧, ૫૬૨, ૫૬૩, ૫૬૪, ૫૬૫, ૫૬૬, ૫૬૭, ૫૬૮, ૫૬૯, ૫૭૦, ૫૭૧, ૫૭૨, ૫૭૩, ૫૭૪, ૫૭૫, ૫૭૬, ૫૭૭, ૫૭૮, ૫૭૯, ૫૮૦, ૫૮૧, ૫૮૨, ૫૮૩, ૫૮૪, ૫૮૫, ૫૮૬, ૫૮૭, ૫૮૮, ૫૮૯, ૫૯૦, ૫૯૧, ૫૯૨, ૫૯૩, ૫૯૪, ૫૯૫, ૫૯૬, ૫૯૭, ૫૯૮, ૫૯૯, ૬૦૦, ૬૦૧, ૬૦૨, ૬૦૩, ૬૦૪, ૬૦૫, ૬૦૬, ૬૦૭, ૬૦૮, ૬૦૯, ૬૧૦, ૬૧૧, ૬૧૨, ૬૧૩, ૬૧૪, ૬૧૫, ૬૧૬, ૬૧૭, ૬૧૮, ૬૧૯, ૬૨૦, ૬૨૧, ૬૨૨, ૬૨૩, ૬૨૪, ૬૨૫, ૬૨૬, ૬૨૭, ૬૨૮, ૬૨૯, ૬૩૦, ૬૩૧, ૬૩૨, ૬૩૩, ૬૩૪, ૬૩૫, ૬૩૬, ૬૩૭, ૬૩